
	<p>મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ સરદાર પટેલ વિદ્યુત ભવન, રેસકોર્સ, વડોદરા -૩૯૦૦૦૭.</p> <p>CIN :U40102GJ2003SGC042907 ફેક્સ નં. (૦૨૬૫) ૨૩૩૭૯૧૮, ૨૩૩૮૧૬૪ ફોન નં. (૦૨૬૫) ૨૩૧૦૫૮૩ થી ૮૬ ઇમેઇલ : <a href="mailto:cetech.mgvcl@gmail.com">cetech.mgvcl@gmail.com</a> ઇમેઇલ : <a href="mailto:ceproj.mgvcl@gmail.com">ceproj.mgvcl@gmail.com</a></p>	
---	---	---

રાજ્યના ગરીબ તેમજ બીપીએલ લાભાર્થીઓના ઉત્કર્ષ માટે ઘર વપરાશના વીજજોડાણો વીના મુલ્યે આપવા રાજ્ય સરકારશ્રી ધ્વારા ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજના અંતર્ગત નાંણાકીય સહાય ગ્રાન્ટ રૂપે ફાળવવામાં આવે છે.

### ❖ ઝૂંપડપટ્ટી વીજળીકરણ યોજનાના હેઠળ ઘરવપરાશ નાં વીજજોડાણ અંગેની

#### રૂપરેખા :

૧. રાજ્યના કોઈ પણ વિસ્તારમાં આવેલા તમામ જાતિના અને ગ્રામ્ય વિકાસ વિભાગની વેબસાઇટ [www.ruraldev.gujarat.gov.in](http://www.ruraldev.gujarat.gov.in) ઉપર દર્શાવેલ કોમન લિસ્ટ પર ઉપલબ્ધ બીપીએલ લાભાર્થીઓ અને ગરીબ કુટુંબો કે જેઓની મહત્તમ વાર્ષિક આવક રૂ. ૪૭૦૦૦/- ગ્રામ્ય અને રૂ. ૬૮૦૦૦ /- શહેરી વિસ્તાર - હોય તેઓને વીજળીકરણની સુવિધાથી આવરી લેવામાં આવશે. ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત ફાળવવામાં આવેલ પાકા આવાસોમાં રહેતા હોય તેવા બીપીએલ લાભાર્થીઓ અને ગરીબ કુટુંબોની ઉપરોક્ત આવક મર્યાદા હેઠળ આવતા હોય તેઓને પણ ઝૂંપડા વીજળીકરણ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે.  
સદર યોજના હેઠળ ગરીબ કુટુંબોને નિ:શુલ્ક ઘરવપરાશનું વિજજોડાણ આપવામાં આવે છે.
૨. ગ્રામ પંચાયતો / સરકારની / નગર પાલીકાની / મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન ઉપર આવેલ ઝૂંપડપટ્ટી ને આ યોજના હેઠળ આવરી શકાશે. પરંતુ આવા ઝૂંપડાઓમાં વીજળીકરણ મંજૂર કરતા પહેલા વીજળીકરણની સુવિધાથી લાભાર્થી , જમીનની માલિકીની કાયદેસરતા સાબીત કરી શકશે નહિ.
૩. પોતાની ખાનગી માલિકીની જમીન પર જો લાભાર્થીએ ઝૂંપડુ બનાવેલ હોય તો એને સદર યોજનાનો લાભ મળી શકે. પરંતુ અન્યની જમીન પર ઉભા કરાયેલ ઝૂંપડામાં આ યોજના હેઠળ વીજળીકરણ મંજૂર કરી શકાશે નહિ.
૪. જે ઝૂંપડાઓ સલામતીની દ્રષ્ટિએ વીજળીકરણ કરવા યોગ્ય હોય અને એની ઉંચાઈ સાત ફૂટ કરતા વધારે હોય એવા તમામ ઝૂંપડાઓને આ યોજના હેઠળ વીજળીકરણમાં આવરી લઈ શકાશે. મીટર રાખવાની વ્યવસ્થા એટલે કે લાકડાના બોર્ડ પર પાણી ન પડે એવી વ્યવસ્થા હોવી જરૂરી છે. પરંતુ પ્લાસ્ટીક કે વાંસથી બનાવેલ કાચા - અડધા પાકા ઝૂંપડાઓને આ યોજનાનો લાભ મળી શકશે નહિ.

૫. જુથમા આવેલ ઝૂંપડાઓને અગ્રીમતાના ધોરણે લાભ આપવાનો થાય છે. છૂટા છવાયા ઝૂંપડાઓને ત્યાર બાદ આવરવામા આવે છે.
૬. સ્થાનિક કક્ષાએ તાલુકા પંચાયત / મ્યુનિસિપલિટી / નગર પાલીકાએ ઝૂંપડપટી વીજળીકરણ માટેની લાભાર્થીઓની યાદી તૈયાર કરી આનુસાંગીક વીજ કંપનીઓને પુરી પાડવાની રહેશે.
૭. આ યોજના હેઠળ લાભાર્થીઓને કુટિર જ્યોતિ યોજનાની જેમજ એક પોઇન્ટ વાયરીંગ કરી, મીટર મૂકી, સીએફએલ બલ્બ સાથે વીજ જોડાણ આપવામા આવશે અને આ માટે ટેસ્ટ રીપોર્ટ આપવો જરૂરી નથી. આ યોજના હેઠળ જરૂર જણાય ત્યા નવી લાઈન કે ફીડરો નાખવા કે ક્ષમતા વધારો કરી શકાય. સીસ્ટમ ઇમ્પ્રુવમેન્ટના કામો પણ કરી શકાશે.
૮. બીપીએલ લાભાર્થી ઓને પ્રતિમાસ બીલની રકમમાં પ્રથમ ૩૦ યુનિટમાં રૂ. ૧.૫૦ પૈસાના રાહત દરે વીજ બીલની આકારણી કરવામાં આવે છે.
૯. આ યોજના અંતર્ગત લાભાર્થીની યાદી ગ્રામ્યટ વિસ્તાર માટે સમાજ કલ્યાણ વિભાગ ધ્વારા વીજ વિતરણ કંપનીઓને ઊપલબ્ધ કરવામાં આવે છે, જ્યારે શહેરી વિસ્તાર માટે યોજના અંતર્ગત લાભાર્થીની યાદી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ધ્વારા આપવામાં આવે છે.

વર્ષ ૨૦૧૬-૧૭ માં ૭૦૦૦ ઘરવપરાશના વીજ જોડાણો આપવાનું આયોજન છે.